



સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન
સરનામુ-જુનુ હેડ ક્વાર્ટર, અઠવાલાઇન્સ,
સુરત શહેર



અલગ અલગ ઇલેક્ટ્રોનીક્સ દુકાનોમાંથી ઇલેક્ટ્રોનીક્સ સામાન ખરીદ કરી તથા OLX ઉપરથી મોબાઇલ ફોન તથા એપલ વોચ ખરીદ કરી, તેઓને પેમેન્ટ ઓનલાઇન ટ્રાન્સફર કરેલ હોવાની બોગસ રસીદ બતાવી, પેમેન્ટની ચુકવણી ન કરી, છેતરપીંડી કરનાર આરોપીની ઝડપી પાડતી, સુરત શહેર સાયબર ક્રાઇમ.

વરાછા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૪૪૭/૨૦૧૮ ઇ.પી.કો. કલમ-૪૦૬, ૪૨૦ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જે ગુન્હામાં સંડોવાયેલ અજાણ્યા ઇસમે રોહન ખન્ના તરીકેનું ખોટું નામ ધારણ કરી, અલગ અલગ ઇલેક્ટ્રોનીક્સ સામાન ખરીદ કરી, તેઓને પેમેન્ટ ઓનલાઇન ટ્રાન્સફર કરેલ હોવાની બોગસ રસીદ બતાવી પેમેન્ટની ચુકવણી ન કરી છેતરપીંડી કરેલ હતી તથા સુરત શહેરના અન્ય પો.સ્ટે. વિસ્તારમાં પણ આ રીતે સદર ઇસમે અન્ય લોકો સાથે પણ છેતરપીંડી કરેલ હોય, સદર આરોપીને શોધી કાઢવા સારૂ અધિક પોલીસ કમિશ્નરશ્રી ટ્રાફિક અને ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી, ક્રાઇમ બ્રાન્ચનાઓએ સુચના આપેલ હોય, જેથી મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી, સાયબર ક્રાઇમ નાઓના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ તે દરમિયાન સાયબર ક્રાઇમ પો.સ્ટે.ના એ.એસ.આઇ.પૃથ્વીરાજસિંહ તખતસિંહ તથા અ.પો.કો. યોગેશભાઇ ચંદુભાઇ નાઓને મળેલ બાતમી આધારે સદર ગુન્હામાં સંડોવાયેલ રોહન ખન્ના નામ ધારણ કરનાર આરોપી અભિષેક ઉર્ફે રોહન ખન્ના S/O સુરેશકુમાર નંદવાણી ઉ.વ.૨૭ ધંધો-વેપાર રહે. એ/૫૦૩, મધુરમ એપાર્ટમેન્ટ, ભટાર ચાર રસ્તા પાસે, ભટાર રોડ, સુરત તથા સી/૫૦૪, સુત્રાલી એપાર્ટમેન્ટ, સુભાષ ગાર્ડન પાસે, જહાંગીરપુરા, સુરતને શોધી કાઢી તેની પાસેથી (૧) બ્લ્યુ સ્ટાર કંપનીનું (૧.૫ ટનનું) એ.સી. કિંમત રૂ.૩૩,૫૦૦/- (૨) ચાઇના સ્માર્ટ કંપનીનું ૫૦ ઇંચનું ટી.વી. કિંમત રૂ.૩૩,૫૦૦/- (૩) ચાઇના કંપનીનું ૩૨ ઇંચનું ટી.વી. કિંમત રૂ.૧૨,૦૦૦/- (૪) ચાઇના કંપનીનું ૩૨ ઇંચનું ટી.વી. કિંમત રૂ.૧૨,૦૦૦/- (૫) ઇન્ટેક્સ કંપનીનું 6.0 kg નું વોશીંગ મશીન કિંમત રૂ.૧૩,૦૦૦/- (૬) MITSUBISHI કંપનીનું એ.સી. કિંમત રૂ.૫૩,૫૦૦/- (૭) Whirlpool કંપનીનું એ.સી. કિંમત રૂ.૩૨,૦૦૦/- (૮) માઇક્રો ફ્રાઇટર કંપનીની ધરઘંટી કિંમત રૂ.૧૧,૫૦૦/- (૯) એપલ કંપનીની ગ્રે કલરની SERIES 3 વોચ કિંમત રૂ.૨૦,૦૦૦/- (૧૦) એપલ કંપનીનો મોડલ નં. A1660 નો મોબાઇલ ફોન કિંમત રૂ.૧૮,૦૦૦/- મળી કુલ કિંમત રૂ.૨,૩૯,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરી મજકુર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબજો આગળની વધુ તપાસ અર્થે વરાછા પો.સ્ટે. તરફ સોંપવા તજવીજ કરેલ છે.

એમ.ઓ.

આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી અલગ અલગ ઇલેક્ટ્રોનીક્સ દુકાનમાં જઇ ઇલેક્ટ્રોનીક્સ સામાન ખરીદ કરવાનું જણાવી રોહન ખન્નાના નામનું બીલ બનાવી દુકાનદાર પાસેથી એકાઉન્ટ નંબર મેળવી તે એકાઉન્ટમાં પેમેન્ટ ઓનલાઇન ટ્રાન્સફર કરેલ હોવાની બોગસ રસીદ બતાવી પેમેન્ટની ચુકવણી ન કરી છેતરપીંડી કરેલ છે. તેમજ આ રીતે OLX ઉપરથી મોબાઇલ ફોન તથા એપલ વોચ ખરીદ કરેલ છે.

ડીટેક્ટ કરેલ ગુન્હાની વિગત-

- (૧) વરાછા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૪૪૭/૨૦૧૮ ઇ.પી.કો. કલમ-૪૦૬, ૪૨૦ મુજબ
- (૨) વરાછા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૨૦૩/૨૦૧૯ ઇ.પી.કો. કલમ-૪૦૬, ૪૨૦ મુજબ
- (૩) કતારગામ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૩૪/૨૦૧૯ ઇ.પી.કો. કલમ-૪૦૬, ૪૨૦ મુજબ

આ કામગીરી સાયબર પો.સ્ટે.ના પો.સ.ઇ. જે.બી.આહીર તથા એ.એસ.આઇ. પૃથ્વીરાજસિંહ તખતસિંહ તથા એ.એસ.આઇ. સંદિપસિંહ અશોકસિંહ તથા અ.હે.કો. સુનિલ કિશોરભાઇ તથા અ.હે.કો. મહેન્દ્રસિંહ પ્રવિણસિંહ તથા અ.પો.કો. યોગેશભાઇ ચંદુભાઇ તથા અ.પો.કો. પિયુષ અશોકભાઇ તથા અ.પો.કો. ચિરાગ દામજીભાઇ નાઓએ કરેલ છે.